

કલેક્ટર કચેરી, પાટણ હસ્તકના સરકારી વાહનની જાહેર હરાજી

કલેક્ટરશ્રી, પાટણ હસ્તકના સરકારી વાહન GJ-24-G-999 (ટોયોટા ઈનોવા 2.5 LE-7S - ડીઝલ - 2009) નો નિકાલ કરવાનો હોઈ રસ ધરાવતા ઈસમો પાસેથી નિયત પત્રકમાં ભાવો સીલ બંધ કવરમાં કલેક્ટર કચેરી, પાટણ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સામે, પાટણ - ૩૮૪૨૬૫ ની રજીસ્ટ્રી શાખામાં તા. ૦૧/૦૬/૨૦૨૦ ના ૧૭.૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે સ્પીડ પોસ્ટ/RPAD/રૂબરૂમાં મોકલી આપવા જણાવવામાં આવે છે. સદર વાહનની અપસેટ કિંમત રૂ. ૧,૭૫,૦૦૦/- નક્કી કરવામાં આવેલ છે. હરાજીમાં રસ ધરાવનાર ઈસમોએ ભાવપત્રકો સાથે કલેક્ટરશ્રી, પાટણના નામનો પાટણ ખાતે ચૂકવવાપાત્ર રૂ. ૫૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ સામેલ કરવાનો રહેશે. ડિમાન્ડ ડ્રાફ્ટ વગરના ભાવપત્રક વિચારણામાં લેવામાં આવશે નહીં. સીલબંધ કવર પર "વાહન હરાજીના ભાવ" એમ મોટા અક્ષરે દર્શાવવાનું રહેશે. ભાવ ભરનાર ઈસમો ઈચ્છે તો સદર વાહન કામકાજના ચાલુ દિવસે કચેરી સમય દરમિયાન કલેક્ટર ઓફિસ, પાટણ ખાતે જોઈ શકશે. ભાવ મંજૂર-નામંજૂર કરવાની તમામ સત્તા આ કચેરીને અબાધિત રહેશે. આ કચેરી તરફથી આ માટે કરવામાં આવેલ તમામ શરતો ભાવ ભરનારને બંધનકર્તા રહેશે. ભાવ રજૂ કરવાનો નિયત નમૂનો તથા હરાજી માટેની શરતો કલેક્ટર કચેરી, પાટણના નોટીસ બોર્ડ પર તેમજ વેબસાઈટ <https://patan.nic.in> પર જોવા મળી શકશે. વધુ વિગતો માટે ફોન નં. 02766 232240 પર સંપર્ક કરી શકાશે.

(સહી)

કલેક્ટર, પાટણ

કલેક્ટર કચેરી, પાટણ હસ્તકના સરકારી વાહનની જાહેર હરાજી

વાહન નં. GJ 24 G 999

ભાવો રજૂ કરવા માટેનું નિયત પત્રક

1. ભાવ રજૂ કરનાર પેઢી / ઈસમનું નામ:
2. પેઢી / ઈસમનું પૂરું સરનામું:
3. મોબાઈલ નંબર:
4. ડીમાન્ડ ડ્રાફ્ટની વિગત: નં., બેંકનું નામ:, તા.
5. રજૂ કરેલ ભાવ
અંકોમાં
શબ્દોમાં

સાહી

પૂરું નામ:

શરતો:

1. ભાવ ભરનાર ઈસમે વાહનની અપસેટ કિંમતની ૩૦ ટકા રકમ પેટે રૂ. ૫૦૦/- (અંકે રૂપિયા બાવન હજાર પાંચસો પુરા)નો પાટણ ખાતે ચૂકવવા પાત્ર કલેક્ટરશ્રી, પાટણના નામે ડીમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાનો રહેશે.
2. હરાજીમાં મૂકેલ વાહનનું બાહ્ય નિરીક્ષણ કરવા ઈચ્છતા ઈસમો સદર વાહન કચેરી કામકાજના ચાલુ દિવસે કચેરી સમય દરમિયાન કલેક્ટર ઓફિસ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સામે, પાટણ ખાતે જોઈ શકશે.
3. નિયત સમય સુધીમાં રજૂ થયેલ ભાવો હાજર ઈસમોની રૂબરૂમાં શક્ય હશે તો તા. ૦૨/૦૬/૨૦૨૦ ના રોજ ૧૬.૦૦ કલાકે કલેક્ટર કચેરી, પાટણ ખાતે ખોલવામાં આવશે.
4. આ વાહનની જાહેર હરાજીથી બોલી બોલવામાં આવશે નહિ. જે પેઢી / ઈસમ તરફથી સૌથી ઊંચા ભાવ રજૂ થયેલ હશે તે જ ભાવો વિચારણામાં લેવામાં આવશે.
5. સૌથી ઊંચો ભાવ ભરનાર ઈસમે ઉપર મુજબ ૩૦% રકમ ડીમાન્ડ ડ્રાફ્ટ સ્વરૂપે ભાવ પત્રકો સાથે મોકલેલ હશે તે જમા રાખવામાં આવશે અને બાકી રહેતી તમામ રકમ હરાજી મંજૂરીની જાણ કર્યા તારીખથી ૧૫ દિવસમાં ભરપાઈ કરી વાહનનો પ્રત્યક્ષ કબજો મેળવી લેવાનો રહેશે. અન્યથા ભરેલી ૩૦% રકમ સરકાર પક્ષે જપ્ત કરી પુનઃ હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
6. હરાજી ચાલુ રાખવી કે મુલતવી રાખવી તે અંગેના અબાધિત અધિકાર હરાજી યોજનારના રહેશે.
7. હરાજીમાં મૂકવામાં આવેલ વાહન જે સ્થિતિમાં હશે તે જ સ્થિતિમાં આપવામાં આવશે. જેથી દરેક ઈસમે આ વાહન સ્થળ ઉપર જોઈ તપાસીને ભાવ ભરેલ છે તેમ માની લેવામાં આવશે અને પાછળથી આ બાબતે કોઈ તકરાર ચાલશે નહિ.
8. હરાજી નામંજૂર કરવામાં આવે તો હરાજી વખતે ઊંચા ભાવ ભરનાર ઈસમે જે રકમ ભરપાઈ કરેલ હશે તે રકમ તેઓને ચેક મારફતે ચૂકવી આપવામાં આવશે. ભરેલ રકમ ઉપર વ્યાજ કે કમીશન આપવામાં આવશે નહિ.
9. શરતી ભાવો સ્વીકારવામાં આવશે નહિ.
10. ભાવો ખોલ્યા બાદ કોઈ પણ ઈસમની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
11. ભરેલ ભાવોમાં સૌથી ઊંચા ભાવ ઉપર વેચાણવેરો કે બીજા અન્ય ટેક્ષ ભરપાઈ કરવાના થશે તો તે જે તે ઈસમે (વાહન રાખનારે) હરાજીની કિંમત ઉપરાંત ભરપાઈ કરવાના રહેશે. જે ભરપાઈ કર્યા બદલની પહોંચ રજૂ કરેથી વાહનનો કબજો સોંપવામાં આવશે.
12. જાહેર હરાજીમાં વાહન રાખનાર ઈસમે નામ તબદીલ વર્ગેરે બાબતની તમામ કાર્યવાહી સ્વખર્ચે કરાવી લેવાની રહેશે.

ઉપર મુજબની શરતો જે મે વાંચી છે જે મને બંધનકર્તા છે.

ભાવ રજૂ કરનારની સાહી: